મહા વાવાઝોડાના પ્રભાવની શક્યતાને પગલે વાવાઝોડા પૂર્વે

વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ કેટલાક પગલાઓ ભરવા જરૂરી બને છે

રાજયના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી તા. ૬ અને તા.૭ નવેમ્બર-૨૦૧૯ દરમિયાન મધ્યરાત્રિ કે મોડી સવારના સમયે મહા વાવાઝોડા આવશે તેવા હવામાન ખાતાના અહેવાલ અને આગાહી છે. મહા વાવાઝોડાના પ્રભાવની શક્યતાને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટીતંત્ર સર્તાક અને વધુ અસરકારક બન્યું છે. રાજયમાં સંભવિત આપત્તિ વખતે વડોદરા જિલ્લાના નાગરિકોને સહકાર આપવા જિલ્લા પ્રશાસને અનુરોધ કર્યો છે.

સંભવિત મહા વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સુરક્ષાના પગલે રાજય સરકાર દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે તે મુજબ નાગરિકોએ ગભરાયા વિના શાંત રહીને સહકાર આપવો જરૂરી છે. વાવાઝોડા પૂર્વે, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું–શું પગલાઓ ભરીને સમજદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો

મહેશ્વર, ગુરૂ શાક્ષાત પરમ બ્રહ્મા,

તસમેય ની ગુરૂ દેવ નમઃ આજે પરસ્પર

દેવો ભવનું વિશ્વભરમાં સાર્થક કરનાર

અલગારી અને મહાન સંત પુ.શ્રી રંગ

અવધૃત મહારાજની ૧૨૧મી જન્મ

સંત શ્રી રંગઅવધૃતજીની તપોભૂમિ

નારેશ્વર તેમજ શહેરના કિર્તિમંદિર,

આ શુભ અને પાવન પર્વ પર

જયંતિ છે.

વાવાઝોડા સામે પૂર્વ તૈયારના ભાગરૂપે રેડિયો. ટીવી અને સમાચારો તથા જાહેર ખબરોના સંપર્કમાં રહેવં, ઘરના બારી-બારણા તથા છાપરાઓને મજબૂત કરવા, તાત્કાલિક જરૂરિયાત હોય તે ખોરાક, ફાનસ, ટોર્ચ, પાણી અને કપડા સહિતની વસ્તુઓ તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી માળિયે ખસેડી દેવો, વાહનોને ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જોખમી જણાય ત્યારે વાવાઝોડાની આગાહી થાય કે તુરંત સલામત સ્થળે ખસેડી લેવા, અફવાઓથી દૂર રહેવું અફવાઓ ફેલાવવી નહિ, ગભરાયા વિના શાંત રહેવં, સ્થાનિક સ્તરે અધિકારીઓના સંપર્કમાં રહેવું, પાલતુ પ્રાણીઓને છુટાં કરી સલામત સ્થળે ખસેડવા, માછીમારોએ દરિયામાં જવું નહિ અને હોડીઓને સલામત સ્થળે ખસેડવી જરૂરી છે.

વાવાઝોડા દરમિયાન પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું, ઝાડ-

શહેરમાં શ્રી રંગ અવધ્ત મહારાજની

જન્મજયંતિએ ગુરૂમંદિરોમાં ઉજવણી

સુહાસ ફેલાવતા મંદિરોમાં ભક્તો દ્વારા

આસ્થા-ઉમંગ તેમજ શ્રધ્ધાભેર

વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ઉજવણી

નારેશ્વરની તપોભૂમિ ખાતે આજે ૧૨૧

દિવડાની મહાઆરતી કરવામાં આવી

હતી. જેમાં દેશભરમાંથી હજારો ભક્તો

ઉમટી પડયા હતા. ખાસ કરીને

વડોદરાની રંગવાટીકા ખાતે યોજાનાર

મहા વાવાઝોડાના સંકટને કારણે નર્મદા

પરિક્રમા અટકી : અનેક મુસાફરો પરત ફર્ચા

૩૬૦૦ કિમીની પરિક્રમા બે

ભાગમાં શરૂ થાય છે. જેમાં પહેલા

હાંસોટ પાસેનાં વમલેશ્વર કતપોર

ગામમાં પર્ણ કરીને હોડીમાં નર્મદા

સંગમ સ્થાનમાં દરિયામાંથી પસાર

થઇને દહેજ પાસે પહોંચે છે. આ

પરિક્રમા દરેશા બાદ શરૂ થાય છે

અને દિવાળી પછી પરિક્રમાવાસીઓ

વધુ પ્રમાણમાં આવે છે. ત્યારે મહા

વાવાઝોડાનાં સંકટને કારણે

વમલેશ્વર હોડી ઘાટ બંધ કરવામાં

આવ્યો છે. જેના કારણે ૨૦૦થી વધુ

મુસાફરોને પરત ફરવાની ફરજ પડી

હતી.નોંધનીય છે કે, પુરાણોમાં

આવતી વાત પ્રમાશે, નર્મદા

ભગવાન શિવની પુત્રી છે. તે કુંવારી

જિલ્લાના સ્પ્રસિધ્ધ તિર્થક્ષેત્ર

કરવામાં આવી હતી.

સુરસાગર, તેમજભૂતડીઝાંપા ખાતે કાર્યક્રમમાં આચાર્ય અશોકભાઈ

નર્મદા,તા.પ

વધુ

પરિક્રમાવાસીને

'મહા' વાવાઝોડાનાં સંકટને

કારણે નર્મદા પરિક્રમા અટકાવી

દેવામાં આવી છે. હાંસોટનાં

વહીવટી તંત્ર દ્વારા વમલેશ્વર હોડી

ઘાટ બંધ કરવામાં આવ્યો છે. ૪

પરિક્રમાવાસીઓ અધૂરી પરિક્રમા

કરી પરત ફર્યા છે. પ૦થી વધુ

વમલેશ્વર આશ્રમ તેમજ કતપોર

ગામે રોકાશ કરવાની ફરજ પડી છે.

આ ઉપરાંત આલીયાબેટ અને

હાંસોટનાં નાવિકોને નદી અને

દરિયો ન ખેડવા માટેની સૂચના

આપવામાં આવી છે.નર્મદા નદીની

મરણ પ્રસંગ દરમ્યાન ઘર

આંગણે પાર્ક કરેલી

બાઈકની ચોરી

બસમાં

૨૦૦થી

આવેલ ઐતિહાસિક તેમજ શ્રધ્ધાની શાસ્ત્રીજી સાંજે ૫.૦૦થી ૭.૦૦ કલાક

બહાર ન નીકળવું, વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા, ઘરના તમામ બારી-બારણાઓ બંધ રાખવા, ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલરૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.

વાવાઝોડા બાદ સત્તાવાર સૂચનાઓ મળ્યા બાદ જ બહાર નીકળવું હિતાવહ છે. અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહી, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર પૂરી પડવા દવાખાને ખસેડવા, કાટમાળની સ્થિતિ સર્જાય તો કાટમાળમાંથી ફસાયેલાઓને તુરંત બચાવી લેવા બનતા પ્રયત્નો કરવા, ખુક્ષા-છૂટાં પડેલા વાયરોને અડકવું જોખમી છે.

ભયજનક કે અતિ નુકશાન પામેલ મકાનોને ઉતારી દેવા જોઇએ. ક્લોરીનયુક્ત પાણી પીવું જોઇએ. ભરાય ગયું હોય તેવા ગંદા પાણીમાં દવાનો છંટકાવ કરી દેવાથી રોગચાળાનો ભય ઓછો રહે છે.

દરમિયાન પાદ્કા પુજન પછી જન્મ

વધામણા કથામૃતનું રસપાન કરાવશે.

રંગ અવધુત મહારાજે નારેશ્વરને

તપોભૂમિ તરીકે પસંદ કરી હતી. રંગ

અવધૃત મહારાજનો જન્મ ગોધરા ખાતે

તા.૨૧-૧૧-૧૮૯૮ રોજ થયો હતો.

જયારે દેહવિલય હરિદ્વારમાં તા.૧૯-

૧૧-૧૯૬૮ના રોજ થયો હતો.

અત્યેષ્ટી નારેશ્વરની પવિત્રભૃમિ પર

તા.૨૧-૧૧-૧૯૬૮ના રોજ સંપન્ન

છે એટલે કે સાગરમાં મળતી નથી

અને આખા ભારતમાં આ એક એવી

નદી છે, જેની પરિક્રમા શક્ચ છે.

આ પરિક્રમા કરી અનેક લોકો

મનની શાંતિ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ

પરિક્રમા ૨૧ દિવસમાં પૂરી કરી

શકાય છે અને આ પરિક્રમા ચૈત્ર

માસમાં જ કરવામાં આવે છે. હાલ

ભારતભરમાંથી મા નર્મદાના

ભક્તો દ્વારા ૨૧ દિવસ માટે

પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો

છે, જેમાં હજારો ભાવિકો જોડાય છે.

આ પરિક્રમા રોજ ૧૨ કિલોમીટર

પગપાળા ચાલવામાં આવે છે.

ખાસ કરીને પંચકોશી નર્મદા

મહા વાવાઝોડા અંગે આરોગ્ય વિભાગનો શ્રી

વડોદરા, તા.પ

ગુજરાત પર મહા વાવાઝોડુ ત્રાટકવાની શકયતાને ધ્યાનમાં રાખી રાજયના આરોગ્ય તબીબી કમિશ્નર દ્વારા ખાસ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં જીક્ષા અને તાલુકા કક્ષાએ ૨૪ કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરવા જણાવાયું હતું. તદુપરાંત તમામ અધિકારીઓ કર્મચારીઓને હેડકવાર્ટર નહી છોડવાની તાકીદ કરવામાં આવી છે. રાજયના આરોગ્ય વિભાગ તથા અન્ય જીજ્ઞાઓ અથવા તાલુકા કક્ષાએથી મળતી માહિતી અને વિગતો પ્રમાણેની તૈયારી કરવા પણ જણાવાયું છે.વાવાઝોડા દરમિયાન હાથ ધરવાની કામગીરી અને નૂકસાન થયા પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી અંગે પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. તમામ હોસ્પિટલો આરોગ્ય કેન્દ્રો ખાતે જરૂરી દવાઓ તથા પુરતા સાધનો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની તાકીદ કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ સેવાને કોઈ અસર ન થાય તેવી રીતે તમામ તૈયારીઓને અંતિમઓપ આપવા જણાવાયું છે.

સોની સબ પર તેનાલી રામામાં શું રામા राषडुभारी हेपयानीने

સોની સબ પર વ્યાપક રીતે ખ્યાતિ પ્રાપ્ત ઐતિહાસિક ફિશકન શો તેનાલી સમાએ નવા નવા અને અણધાર્યા વળાંકો સાથે તેના દર્શકોને સ્ક્રીન સાથે જકડી રાખ્યા છે. રતિ પાંડોનો શોમાં રાજકુમારી દેવયાની તરીકે પ્રવેશ પછી શોમાં વધુ ડ્રામા, વધુ બુધ્ધિ અને વધુ હાસ્ય આવ્યું છે. જેમાં દર્શકોને એવું જોવા મળશે કે ભાસ્કર (કૃષ્ણ ભારદ્વાજ) વિજયનગરના ભાવિને બચાવવા માટે તેની બુધ્ધિ કામે લગાવવા માટે રામાનો સ્વાંગ રચે છે. જામવંતની રાજકુમારી દેવયાની રામાને તેના દ્વારા રજુ કરાયેલું કોયડું ઉકેલવા પડકારાય છે. અને જો રામા નિષ્ફળ જાય તો જાનવંતનું શાસન વિજયનગર પર યુધ્ધ જાહેર કરશે. રામા વિજયનગરને બચાવવા માટે સંપૂર્ણ દરબારની સામે પડકાર ઝીલી લે છે. રામાની બ્ધિ અને ચતુરાઈથી પ્રભાવિત રાજકુમારી દેવયાની તેના પ્રેમમાં પડે છે અને પડકારના નિયમોમાં

બધા કોયડાના સાચા ઉત્તરો આપશે તો હું તેની જોડે પરણી જઈશ. રામા ઘેરી મુંઝવણમાં છે, કારણ કે હવે તે પોતાનું શાસન અથવા પોતાને બચાવી શકે છે. રામા વિજયનગરને વિનાશના ખતરાથી બચાવવા માટે આ લગ્નના પ્રસ્તાવમાંથી બહાર આવવા શું કરશે? શું રામા અને દેવયાનીના લગ્ન ખરેખર થશે? રામાની ભૂમિકા ભજવતો કૃષ્ણ ભારદ્વારજ રહે છે. સામે બે માર્ગ છે અને તેમાંથી કોઈ તેને સ્વીકારવો નથી રાજકુમારી દેવયાનીએ રામાને અવઢવમાં મુકી દીધો છે. જેમાં રામા દેવયાનીને પરણી શકે અથવા યુધ્ધનો સામનો કરવો પડશે. આગામી એપિસોડમાં દર્શકોને રામાની શ્રેષ્ઠતમ ચતુરાઈનો ફરીથી પરચો થશે. અને રામા પોતાને અને વિજયનગરને રાજક્મારી દેવાનીના આ ઝળુંબતા આતંકમાંથ બચાવી શકશે કે કેમ તે જોવું રહયું. શું રામાની નીકળશે જાન? જાણવા માટે જોતા રહો તેનાલી રામા,દર સોમવારથી શુક્રવાર, સાંજે

ચોંકાવનારો ઉમેરો કરે છે. જો રામા ૭.૩૦ ફકત સોની સબ પર. श्री नहन इरियर गुજरात छान्ड લીકરશીપ એવોર્ડ-૨૦૧૯ સમ્માનિત

ગુજરાત સહિત દેશમાં ૭૫૦થી વધુ બ્રાન્ચો ધરાવતી નં.૧ અને ગ્રાહકોની વિશ્વાસ પાત્ર એવી એક માત્ર કુરિયર કંપની નંદન કુરિયરની યશકલગીમાં વધુ એક છોગ્ ઉમેરાયું છે. તાર્જેતરમાં નંદન કુરિયર કંપનીને ગુજરાત બ્રાન્ડ લીડરશીપ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

ભારતના જાણીતા અને મોટા મિડીયા ગ્રૂપ એવા એબીપી ન્યુઝ નેટવર્કની ગુજરાતી ન્યુઝ ચેનલ એબીપી અસ્મિતા દ્વારા યોજાયેલી ગુજરાત બ્રાન્ડ લીડરશીપ એવોર્ડઝની સેકન્ડ એડીશનમાં નંદન ફરીયર કંપનીને ૨૦૧૯નો બ્રાન્ડ લીડરશીપ એવોર્ડ મળ્યો છે. અમદાવાદમાં યોજાયેલા ગુજરાત બ્રાન્ડ લીડરશીપ એવોર્ડઝ સમારોહમાં લીડરશીપ એવોર્ડને મેળવ્યા બાદ આ અંગે ની નંદન કુરિયર કંપનીના ડાયરેકટર રમેશ ભોગાયતાએ જણાવ્યું હતું કે, શ્રી નંદન ક્રિયર સર્વિસ આજે ગ્રાહકોના વિશ્વાસથી એક આગવી બ્રાન્ડ બની ગઈ છે. અને બ્રાન્ડ લીડરશીપનો એવોર્ડ મેળવતા અમને ખુબજ ખુશીનો અનુભવ થયો છે.

આ એવોર્ડ પાછળ અમારા કર્મચારીઓ તેમજ અમારા માનવંતા ગ્રાહકોનો મોટો ફાળો છે. નંદન ક્રિયર સર્વિસ દ્વારા કયારેય પણ બીજાથી અગાળ નીકળવાની કે વધુને વધુ બ્રાન્ચો ખોલી નેટવર્ક ઉભ્ કરવાની સ્પર્ધા નતી કરી પરંતુ હંમેશા ગ્રાહકને જ કેન્દ્ર સ્થાને રાખી કરિયર સર્વિસમાં કંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે. જેના લીધે જ આજે ક્રિયર સર્વિસમાં શ્રી નંદન એક બ્રાન્ડ લીડર બની છે.

શ્રી નંદન કરિયર કંપનીની સ્થાપના થયાના હજુ માત્ર છ જ વર્ષ થયા છે અને છ વર્ષના ટુંકા ગાળામાં ની નંદન કુરિયરે સારી એવી સફળતા મેળવવા સાથે અનેક સિધ્ધિઓ હાંસ કરી છે.

મહા સંકટ : જાફરાબાદનાં ૩, રાજુલાનાં ૩ ગામો પર સૌથી વધુ ખતરો ઓલપાડના ૩૦ ગામો એલર્ટ પર

અરબી સમુદ્રમાં ઉદભવેલા મહા વાવાઝોડાની અસરનાં ભાગરૂપે રાજ્યમાં ભારે વરસાદની અને દરિયો તોફાની બનવાની શક્ચતા હોય વહીવટીતંત્રને સતર્ક થયું છે. વાવાઝોડું 'મહા' ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૭મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાશે. વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે પરંતુ તેની અસર તો યથાવત રહેવાની સંભાવના છે. જેના કારણે દરિયાકાંઠાનાં નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાતંર કરવામાં આવશે તેવી યોજના છે.જાફરાબાદ તાલુકાનાં ૩ અને રાજુલા તાલુકાનાં ૩ ગામે પર સૌથી વધુ ખતરો મંડરાઇ રહ્યો છે. દરિયાઈ પટ્ટીથી એક કિ.મી. વિસ્તારમાં આવતા કુલ ૧૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

રવાના થઇ છે. માચ્છીમારોને દરિયો નહી ખેડવા તંત્રની તાકિદ છે. અમરેલી ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. આપાતકાલિન સમયે ૦૨૭૯૨ ૨૩૦૭૩૫ નંબર પર સંપર્ક કરી શકાશે. જિલ્લા કલેકટર આયુશ ઓક દ્વારા તમામ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.દ્વારકાનાં રૂપેણી બંદર પર ૨૦૦૦ બોટ લંગારવામાં આવી છે. હજુ અનેક બોટ મધ્ય દરિયાથી પરત આવી રહી છે. ખેડૂત સાથે માછીમાર સમાજ માટે પણ ચિંતામાં છે. માછીમારોને ચાર મહિનાથી કોઇ રોજગારી ઉભી થઇ નથી. આ પહેલા પણ વાવાઝોડાનાં કારણે માછીમારી થઇ નથી. દરિયામાં હજુ કરંટ આવી રહ્યો છે. પવન દિશા પણ વાવાઝોડાના કારણે બદલાઇ રહી છે. આ પરિસ્થિતિમાં લોકોને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે એનડીઆરએફની એક ટીમ કે, સરકાર તરફથી કોઇ અધિકારી ભાવનગરથી જાફરાબાદ જવા હજુ અમને જોવા પણ આવ્યું નથી.સુરત 'મહા ' વાવાઝોડા ની અસરને કારણે તંત્ર એલર્ટ થયું છે. ઓલપાડનાં ૩૦, ચોર્યાશીનાં ૬ અને મજૂરા તાલુકાનાં ૪ ગામો એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જો જરૂર જણાશે તો આશરે ૮૦૦૦ લોકોનું કરાશે સ્થળાંતર કરવામાં

૩૦ ગામોના એક એક પાકા ઘરને લોકેટ કરાયા છે. દરિયા કિનારાનાં ગામમાં તલાટીને ગામ જ રહેવા સૂચના આપવામાં આવી છે.રાજકોટમાં પણ મહા વાવાઝોડાને કારણે જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. ૪૦ જેટલા નિચાણવાળા ગામોને તકેદારી રાખવા તાકીદ કરવામાં આવ્યા છે.રાજકોટમાં નગરપાલિકાની ૬ ટીમ , મહાનગરપાલિકાની ૮ ટીમ અને ૨ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. ચીફ સેક્રેટરી સાથે વિડિઓ કોંફરન્સ યોજી જિલ્લા કલેકટરે માહિતી આપી છે.

તા.૮મીએ તલસટમાં ચોજાશે સેવાસેતુ કાર્ચક્રમ

तस्यर सिहत हस गामना नागरिङोने ४३री તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધાઓ સુલભ થશે

રાજયના મુખ્યમંત્રી એ જ્યાં માનવી ત્યાં સ્વિધાનું પ્રેરણા સૂત્ર આપ્યું છે. તેને સાકાર કરવા અને લોકો કચેરીઓમાં આવે તેના બદલે વહીવટી તંત્ર, સેવાઓ અને યોજનાઓને લોકો સુધી લઈ જઈને લાભ આપવાના અભિગમ સાથે વડોદરા શહેર-જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બહુધા દર શુક્ર અને શનિવારે સેવા સેતુ કેમ્પસ યોજવાનું રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. નાગરિકોને તેમને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધા સ્થળ પર પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પારદર્શી અને નિર્ણાયક રાજય સરકારના જનકલ્યાણના આશય સાથે સ્થળ પર નિકાલ કરવા જનસુવિધાલક્ષી પારદર્શી અને સરળીકરણ કાર્યપધ્ધતિને અમલી બનાવી છે.

જિલ્લા પ્રશાસન દ્વારા સેવા સેતુના પાંચમા તબક્કા અંતર્ગત આગામી તાં.૮

કામગીરી કરવામાં આવશે.

તા. ૫ , નવેમ્બર, ૨૦૧૯

સ્થળ : મુંબઈ

વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે.

નવેમ્બર-૨૦૧૯ને શુક્રવારના રોજ રાજય સરકારના કૃષિ, પશુપાલન, સવારે ૯ વાગ્યે તલસટ પ્રાથમિક શાળા ખાતે યોજવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા ગ્રામ્ય તાલુકાના સમીયાલા, ગોકુળપુરા, ભાયલી, રાયપુરા, બીલ, ચાપડ, ખલીપુર, તલસટ, મારેઠા અને મુઝારગામડી સહિતના આજુ-બાજુના ૧૦ ગામોના ગ્રામજનો લાભ લઇ શકશે.અત્રે ઉક્ષેખનીય છે કે, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરતી અરજી, આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિકોના

અરજી - કામો. રેશનકાર્ડને લગતી અરજીઓ, અમૃત્તમ અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા આધાર કાર્ડ અરજીઓ, સ્કોલરશીપ યોજનાના લાભોની અરજીઓ,

લેકટોસી (ઈન્ડીયા) લીગીટેડ

સીઆઇએન : એલ૧૫૨૦૧જીજે૧૯૯૧૧ીએલસી૦૧૫૧૮૬ ૨જી.ઓફિસ: સર્વે નં ૬ગામ પોઈચા (રાણીયા) સાવલી, બરોડા- જીજે ૩૯૧૭૮૦

લેકટોસી (ઈન્ડીયા) લીમીટેડ વતી

સહી/- રિદ્ધિ સિધ્ધપુરા

કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફિસર

મેમ્બરશીપ નંબર : એ ૫૬૬૭૧

આથી સૂચના આપવામાં આવે છે કે, સેબી (લીકટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલોઝર

રીકવાયમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના નિયમન ૨૯ અને ૪૭ને અનુસરીને કંપનીના નિયામક

મંડળની બેઠક બુધવાર, તા.૧૩મી નવેમ્બર, ૨૦૧૯ના રોજ જેમાં તા.૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના

રોજ પુરા થયેલ બીજા કવાર્ટર અને અર્ધવાર્ષિક નાણાંકીય પરિણામોની સમીક્ષા અને મંજુરીની

આ માહિતી કંપનીની વેબસાઈટ www.lactoseindialimited.com પર અને બીએસઈ લિમિટેડની

સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળ વ્યક્તિગત લાભ માટેની અરજીઓ, વિધવા અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળની અરજીઓ સ્વીકરવામાં આવશે. આથી તા.૮મીએ તલસટ ખાતે યોજાનાર આ સેવાસેતુ કાર્યક્રમનો સંબંધિત તમામ ગામોના વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા મામલતદાર વડોદરા ગ્રામ્ય દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રમાણપત્રને લગતા દાખલાઓની

CIN: L51900GJ1980PLC065554

Regd Office: Survey No. 364 / 366, At & PO Rania Taluka Savli, Dist; Vadodara - 391780 Phone: 02667 - 244307 / 361 Fax: 02667 - 24437; Email: investors@shaily.com Visit us: www.shaily.com

Notice of Board Meeting

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, meeting of the Board of Directors of the Company is scheduled to be held on Thursday, November 14, 2019, at Rania, Vadodara, interalia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the quarter & half year ended on 30th September, 2019.

The information of the above notice is also available on the website of the Company www.shaily.com and also on the Stock Exchange i.e. www.bseindia.com

Place : Vadodara On behalf of the Board of Directors **Executive Chairman**

વડોદરા, તા.પ પાદરા તાલુકાના વિશ્વામપુરા ગામે ઘર આંગણે સ્ટેરીંગ લોક માર્યા વગર પાક કરેલ ગાડીની ચોરી થતા વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિશ્રામપુરા ગામે વિનોદચંદ્ર ચંદ્રભાઈ પરમાર પોતાના ઘર આંગણે બાઈક પાર્ક કરી હતી. દરમિયાન સ્ટેયરીંગ લોક તેમજ ચાવી બાઈકમાંજ ભુલથી રહી ગઈ હતી. અને તેઓ દાદીના મરણ પ્રસંગે જવા નીકળ્યા હતા. અને ત્યા રોકાયા હતા. આ દરમિયાન તેઓએ ઘર આંગણે પાર્ક કરેલી બાઈક તેની કિંમત રૂા.૨૫૦૦૦ની ચોરી થઈ હતી. આ બનાવ મામલે તેઓએ વડુ પોલીસ મથકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Transpek Transpek Industry Limited

Regd. Office: Marble Arch, 6th Floor, Race Course, Vadodara - 390 007. Ph #: (0265) 2335444 Email: secretarial@transpek.com; Website: www.transpek.com

CIN NO.: L23205GJ1965PLC001343

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2019

Standalone Consolidated Quarter ended Year ended Half Year ended Half Year ended Quarter ended Year ended Half Year ended Half Year ended Quarter ended Quarter ended Quarter ended Quarter ended **Particulars** 30th September, 2019 30th June, 2019 30th September, 2018 31st March, 2019 30th September, 2019 30th September, 2019 30th June, 2019 30th September, 2018 31st March, 2019 30th September, 2019 30th September, 2018 (Unaudited) (Audited) (Unaudited) (Audited) (Unaudited) 11,263 14,323 26,091 Revenue from Operations 11,263 Net Profit / (Loss) for the period (before Tax, 1,888 425 10,131 2,313 3,199 1,888 425 1,697 2.313 3,199 Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax 1.888 425 1,697 10,131 2,313 3,199 1,888 425 1,697 10.131 2,313 3,199 (after Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax 1,546 335 1,093 6,574 1,881 2,121 1,546 335 1,093 6,574 1,881 2,121 (after Exceptional and / or Extraordinary items) Total Comprehensive Income for the period 1,527 75 1,560 7,053 1,602 3,130 1,527 75 1,560 7,053 3,130 1.602 [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] 559 559 559 559 559 559 559 559 559 559 559 Reserves (excluding Revaluation Reserve) as show in the Audited Balance Sheet of the previous year 30,582 30,582 Earnings Per Share (of Rs.10/- each) Basic & Diluted (Rs.)

The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results is available on the Company's website at www.transpek.com and the Stock Exchange's Website at www.bseindia.com.

DATE: 4th November 2019

PLACE: Mumbai

For TRANSPEK INDUSTRY LIMITED BIMAL V. MEHTA MANAGING DIRECTOR DIN:00081171



Transpek Transpek Industry Limited

Regd. Office: Marble Arch, 6th Floor, Race Course, Vadodara - 390 007. Ph #: (0265) 2335444

Email: secretarial@transpek.com; Website: www.transpek.com

CIN NO.: L23205GJ1965PLC001343

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2019

	Standalone							Consolidated						
Particulars	Quarter ended 30th September, 2019 (Unaudited)	Quarter ended 30th June, 2019 (Unaudited)	Quarter ended 30th September, 2018 (Unaudited)	Year ended 31st March, 2019 (Audited)	Half Year ended 30th September, 2019 (Unaudited)	Half Year ended 30th September, 2018 (Unaudited)	Quarter ended 30th September, 2019 (Unaudited)	Quarter ended 30th June, 2019 (Unaudited)	Quarter ended 30th September, 2018 (Unaudited)	Year ended 31st March, 2019 (Audited)	Half Year ended 30th September, 2019 (Unaudited)	Half Year ended 30th September, 2018 (Unaudited)		
Revenue from Operations	12,534	11,263	14,323	59,457	23,797	26,091	12,534	11,263	14,323	59,457	23,797	26,091		
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	1,888	425	1,697	10,131	2,313	3,199	1,888	425	1,697	10,131	2,313	3,199		
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	1,888	425	1,697	10,131	2,313	3,199	1,888	425	1,697	10,131	2,313	3,199		
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	1,546	335	1,093	6,574	1,881	2,121	1,546	335	1,093	6,574	1,881	2,121		
Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,527	75	1,560	7,053	1,602	3,130	1,527	75	1,560	7,053	1,602	3,130		
Equity Share Capital	559	559	559	559	559	559	559	559	559	559	559	559		
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	30,582	-	-	-	-	-	30,582	-	-		
Earnings Per Share (of Rs.10/- each)														
Basic & Diluted (Rs.)	27.66	6.00	19.54	117.69	33.66	37.95	27.66	6.00	19.54	117.69	33.66	37.95		

DATE: 4th November 2019

PLACE: Mumbai

For TRANSPEK INDUSTRY LIMITED **BIMAL V. MEHTA** MANAGING DIRECTOR DIN:00081171

E-AUCTION SALE NOTICE

HOUSING DEVELOPMENT FINANCE CORPORATION LIMITED

HDFC House, Nr. Mithakhali Six Road, Navrangpura, Ahmedabd. Phone: (079) 66307000

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) indicated in Column (A) that the below described immovable property(ties) described in Column (C) mortgaged/charged to the Secured Creditor, the constructive / physical possession of which has been taken as described in column (D) by the Authorised Officer of Housing Development Finance Corporation Limited (HDFC Ltd) Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" as per the details mentioned below: Notice is hereby given to Borrower / Mortgagor(s) / legal heirs, legal representatives (whether known or unknown), executor(s), administrator(s), successor(s) and assign(s) of the respective Borrower(s) / Mortgagor(s) / legal heirs, legal representatives (whether known or unknown), executor(s), administrator(s), admi Column (A) under Rule 8(6) of the Security Interest (Enforcement) Rules 2002.

For detailed terms and conditions of the sale, please refer to the link provided in Housing Development Finance Corporation Limited (HDFC Ltd) Secured Creditor's website i.e. www.HDFC.Com

Sr. No.	Name/s of Borrower(s)/ Mortgager(s)/ Gurantor(s)/ Legal Heirs and Legal Representatives (whether known or unknown) Executor(s), Administrator(s), Successor(s) and Assign(s) of the respective Borrower(s) / Mortgagor(s) / Gurantor(s) (since deceased), as the case may be.	Outstanding dues to be Recovered (Secured Debt) (Rs.)*	Description of the Immovable Property / Secured Asset (1 Sq. mtr. is equivalent to 10.76 Sq.ft)		Reserve Price (Rs.)	Earnest money deposit (Rs.)	Date of Auction and time
	(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
	MR. RAJNIKANT BASUDEO PRASAD (Borrower) Loan A/c no. 609145592	Outstanding Dues: Rs. 16,97,192/- as on 31 st Oct., 2016*	All that peice and parcel of immovable property being Residential Flat No. 502 on 5"Floor in Tower 'A'admeasuring 65.03 sq. Mtrs. of built up area alongwith undivided proportionate road and undivided area of commpon plot no. 1 admeasuring 30.67 sq. Mtrs. out of total 7 buildings (A to G) and 16 Duplexes constructed in a residential scheme of 'SOMNATH HERITAGE', situate, lying and being developed on Non Agricultural land falling within the residential zone bearing old revenue survey no. 118, Block no. 97 admeasuring 6779 sq. Mtrs of Mouje Village Sevasi on Gotri Sevasi Main Road behind Shaishav School in the Registration District and Sub District of Vadodara.	Physical Possession	Rs. 19,00,000	Rs. 1,90,000/-	9 th Dec., 2019 10:00 AM to 11:30 AM
	MR. AMRUTLAL PACHAN VAGHELA (Borrower) Loan A/c no. 609329598	Outstanding Dues: Rs. 12,75,942/- as on 31 st May, 2019*	All that peice and parcel of immovable property being Sub Plot no. 6/95 (20) A admeasuring 67.24 sq. Mtrs. forming a part of Plot No. 6/95 (20) totally admeasuring 300.06 sq. Mtrs. and having its Property Registration no. 12, Opp. Kukma Gram Panchayat, Mouje Kukma, Taluka Bhuj in Registration District Kachchh and Sub Registration District Bhuj.	Physical Possession	Rs. 10,50,000	Rs. 1,05,000/-	9 th Dec., 2019 10:00 AM to 11:30 AM
	MR. BIKRAM JEET SINGH (Borrower) Loan A/c no. 627003584	Outstanding Dues: Rs. 16,13,569/- as on 31 st May, 2019*	All that peice and parcel of immovable property being Residential Flat No. 704 on 7*Floor in Tower 'D'admeasuring 67.88 sq. Mtrs. and 56.76 sq. Mtrs. of carpet area in the residential scheme called 'GOPINATH PRIDE', situate, lying and being developed on Non Agricultural land bearing revenue survey no. 863/2 admeasuring 3054 sq. Mtrs., Revenue Survey No. 864/2 admeasuring 4251 sq. Mtrs. and Revenue Survey No. 865/2 admeasuring 906 sq. Mtrs. Totally admeasuring 8211 sq. Mtrs. out of which part admeasuring 4927 sq. Mtrs. on which the scheme being 'GOPINATH PRIDE'is developed, Mouje Naroda, Taluka Asarva, Registration District Ahmedabad and Sub Registration District Ahmedabad-6 (Naroda)	Physical Possession	Rs. 22,00,000	Rs. 2,20,000/-	9 th Dec., 2019 10:00 AM to 11:30 AM

*together with further interest @ 18% p.a. as applicable, incidental expenses, costs, charges etc. incurred up to the date of payment and / or realisation thereof

NOTE: To the best of knowledge and information of the Authorized Officer of HDFC Limited, there are no other encumbrances in respect of the above immovable properties / Secured Assets mentioned above.

DISCLOSURE OF ENCUMBRANCES/CLAIMS

- The particulars in respect of the Immovable Property / Secured Asset specified herein above have been stated to the best of the information and knowledge of the Authorised Officer / HDFC Ltd. However, the Authorised Officer / HDFC Ltd. shall not be responsible for any error, misstatement or omission in the said particulars. The Bidders are therefore requested in their own interest, to satisfy themselves with regard to the above and all other relevant details / material information pertaining to the abovementioned Immovable Property / Secured
- Statutory dues like property taxes / cess and transfer charges, arrears of electricity dues, arrears of water charges, sundry creditors, vendors, suppliers and other charges known and unknown, shall be ascertained by the Bidder beforehand and the payment of the same shall be the responsibility of the buyer of Secured Assets.
- Wherever applicable, it is the responsibility of buyer of Secured Assets to deduct tax at source (TDS) @ of 1% of the total sell consideration on behalf of the resident owner (seller) on the transfer of immovable property having consideration equal to Rs.50 Lacs and above nd deposit the same with appropriate authority u/s 194 IA of Income Tax Act. **TERMS & CONDITIONS OF SALE:**
- 1. The particulars in respect of the Immovable Property / Secured Asset specified here in above have been stated to the best of the information and knowledge of the Authorised Officer / HDFC Ltd.
- 2. However, the Authorised Officer / HDFC Ltd shall not be responsible for any error, misstatement or omission in the said particulars. The Bidders are therefore requested in their own interest, to satisfy themselves with regard to the above and all other relevant details / material information pertaining to the abovementioned Immovable Property / Secured Asset, before submitting the bids. 3. Statutory dues like property taxes / cess and transfer charges, arrears of electricity dues, arrears of water charges, sundry creditors, vendors, suppliers and other charges known and unknown, shall be ascertained by the Bidder beforehand and the payment of the same
- shall be the responsibility of the buyer of Secured Assets. 4. Wherever applicable, it is the responsibility of buyer of Secured Assets to deduct tax at source (TDS) @ of 1% of the total sell consideration on behalf of the resident owner (seller) on the transfer of immovable property having consideration equal to Rs.50 Lacs and above

8. For any assistance related to inspection of the property, or for obtaining the Bid document and for any other queries, please get in touch with our Authorized Partner I.e. M/s. Shriram Automall India Limited, through its Concern Person being Mr. Dharmendrasingh Chauhan

and deposit the same with appropriate authority u/s 194 I/A of Income Tax Act. 5. Sale is strictly subject to the Terms, Conditions and Disclaimers stipulated in the prescribed E-Auction Bid Document, Offer Acceptance Letter, Public Notice, terms and conditions mentioned hereinbelow and any other related documents.

6. Secured Assets mentioned at for sr. no.1, 2 and 3 are available for inspection on 26th November, 2019 between 10:00 AM to 5:00 PM. 7. E-Auction Bid Document can be obtained on-line from the website https://eauctions.samil.in or can be obtained at HDFC House, Near Mithakhali Six Roads, Navrangpura, Ahmedabad – 380 009.

- through Mobile No.: 07600762777 or Mr. Vinod Nair or Mr. Viren Mistry official of HDFC Limited through Tel. No. 079-66307063 or 079-66307070. 9. Earnest Money Deposit (EMD) amount as mentioned above shall be deposited by the bidders through Demand Draft / Pay Order in Favour of "HDFC Limited" payable at par in sealed envelope and shall be submitted at HDFC House, Near Mithakhali Six Roads, Navrangpura,
- Ahmedabad 380 009 10. Minimum bid increment amount is Rs. 10,000/- (Rupees Ten Thousand Only) for sr. no. 2 and Rs. 20,000/- (Rupees Twenty Thousand Only) for sr. no. 3.
- 11. The offer amount (to be mentioned in e-auction Bid document) shall be above Reserve Price and bidders shall improve their offers in multiples of Bid incremental amount indicated above. 12. E-Auction Bid Document duly filled in along with the details of payment of EMD shall be submitted at HDFC House, Near Mithakhali Six Roads, Navrangpura, Ahmedabad – 380 009.
- 13. The last date of submission of bids in prescribed e-auction Bid Documents with all necessary documents and EMD in stipulated manner is 7th December, 2019. 14. Incomplete E-Auction Bid Document or bids with inadequate EMD amount or bids received after the date indicated here in above shall be treated as invalid.
- 15. Conditional offers shall be treated as invalid.

Date: 05-11-2019

Place: Ahmedabad

- 16. M/s. Shriram Automall India Limited would be assisting the Authorized Officer in conducting the auction through an e-bidding process. 17. Upon receipt of Bid with the necessary documents as mentioned therein and in the sale notice within the stipulated date and time mentioned above, a password/ user ID will be provided by M/s. Shriram Automall India Limited to eligible bidders / prospective purchasers to
- participate in the online auction.
- 18. Necessary trainings will be provided by M/s. Shriram Automall India Limited for the purpose
- 19. The auction by way of e-bidding will be conducted on the date and time indicated in Column (G). 20. The Immovable Property / Secured Asset shall not be sold below the Reserve Price
- 21. On sale of the property the purchaser shall not have any claim of whatsoever nature against HDFC Ltd or its Authorised Officer. 22. The e-bidding would commence and end at the time indicated in Column (G) above. However, if a bid is received 5 minutes prior to the closing time indicated therein, it would get extended by five minutes every time a bid is offered. The auction would end if there is no bid for a
- period exceeding five minutes. 23. It shall be at the discretion of the Authorised officer to cancel the auction proceeding for any reason and return the EMD submitted and HDFC Ltd. will not entertain any claim or representation in that regard from the bidders.
- 24. The Authorized officer has the absolute right to accept or reject the highest and / or all Bid(s) or postpone or cancel the sale, as the case may be without assigning any reasons thereof and also to modify any of the terms and condition of this sale without prior notice.
- 25. The sale shall be conferred on the highest bidder subject to confirmation by Secured Creditor i.e. HDFC Ltd. 26. EMD of successful bidder shall be adjusted and for all other unsuccessful bidders, the same shall be refunded within 10 days from the date of Auction. The Earnest money deposit will not carry any interest.
- 27. Along with Bid Documents the Bidder(s) should also attach his/her photo identity proof such as copy of the passport, election commission card, ration card, driving license, copy of the PAN card issued by the Income Tax department etc. and the proof of residence countersigned by the bidder herself/himself.
- 28. The successful bidder shall be required to pay 25% of the offer amount (including the amount of EMD) immediately i.e. on the same day or not later than next working day, as the case may be(as per the amended provisions of Rule 9(3) of the Security Interest (Enforcement) Rules, 2002) on confirmation of offer acceptance by HDFC, failing which the EMD amount remitted will stand forfeited. The balance 75% of offer amount shall be paid within 15 days of confirmation of sale by the Authorised officer. If the balance amount is not remitted within stipulated time the amount of 25% will stand forfeited as per the amended provisions of Rule 9(4) of the Security Interest (Enforcement) Rules, 2002.

Note: Bidding in the last minute and second should be avoided in bidders own interest. Neither HDFC Ltd. nor the service provider shall be responsible for any lapses / failure (Internet failure, Power failure etc.) on the part of the vendor. In order to ward-off such contingent situation bidders are requested to make all the necessary arrangements / alternatives such as back-up power supply or whatever required so that they are able to participate in the auction successfully.

CAUTION NOTE: Bidders at large are hereby informed that HDFC Ltd and its Authorized Officer does not deal in cash transaction with respect to Immovable Property mentioned in the Auction sale notice. The name and contact details of the agency / broker, if any, authorized by HDFC Limited to deal with sale of Immovable property can be obtained only from the office of HDFC Ltd at the address mentioned above.

For Housing Development Finance Corporation Ltd.

Authorised Officer

Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churchgate, Mumbai- 400020. CIN: L70100MH977PLC019916. E-mail: customercare@hdfc.com, Website: www.hdfc.com

The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results is available on the Company's website at www.transpek.com and the Stock Exchange's Website at www.bseindia.com.



GOBIND SUGAR MILLS LIMITED

Regd. Office: Birla Mill Complex, P. O. Birla Lines, G T Road, Near Clock Tower, Kamla Nagar, North Delhi - 110007 Website: www.gobindsugar.com, email: ig.gsml@adventz.com Phone: +91-124-4827800, CIN: L15421DL1952PLC354222

Extract of Unudited Financial Results for the quarter ended 30th September, 2019

(Rs. in Lacs except per shar									
Quarter ended 30.09.2019	Year ended 31.03.2019	Quarter ended 30.09.2018							
12,472.77	51,665.08	8,631.75							
(3,285.79)	(2,628.17)	(3,042.79)							
(3,285.79)	(2,628.17)	(3,042.79)							
(2,202.73)	(3,582.47)	(1,975.93)							
(2,195.36)	(3,558.94)	(2,040.02)							
447.30	373.09	320.00							
_	(2,399.45)	_							
(49.08) (49.08)	(97.31) (97.31)	(61.75) (61.75)							
	30.09.2019 12,472.77 (3,285.79) (3,285.79) (2,202.73) (2,195.36) 447.30 - (49.08)	Quarter ended 30.09.2019 Year ended 31.03.2019 12,472.77 51,665.08 (3,285.79) (2,628.17) (3,285.79) (2,628.17) (2,202.73) (3,582.47) (2,195.36) (3,558.94) 447.30 373.09 - (2,399.45) (49.08) (97.31)							

- 1. The above is an extract of the detailed format of quarter ended Financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations. 2015. The full format of the said Results are available on website of Metropolitan Stock Exchange of India Ltd. (www.msei.in) and on the Company's website (www.gobindsugar.com)
- 2. Previous periods figures have been regrouped / reclassified, wherever necessary.

For and on behalf of the Board **Gobind Sugar Mills Limited** Sd/- R S Raghavan

Managing Director

Place: Gurugram Date: 04th November 2019

CIN: U67120MH1992PLC068060

Regd Office: 001 & 002 Fulcrum, A Wing, Ground Floor, Sahar Road, Next to Hyatt Regency, Andheri (East), Mumbai - 400 099

Website: www.avanse.com | Email: investorrelations@avanse.com

Avanse Financial Services Limited

T: 022 6859 9999 | F: 022 6859 9900

	Statement of Un-audited Financial	Result for the Half Yea	Ended September 3	0, 2019
				(Rs. In lakhs)
Sr.	Particulars Particulars	Half Year Ended	Half Year Ended	Year Ended
Zo.	Tarriculars	30.09.2019	30.09.2018	31.03.2019
		(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from operations	20,581.77	19,802.74	41,849.25
2	Net Profit / (Loss) before Tax	692.40	2,461.23	4,148.72
3	Net Profit / (Loss) after Tax	327.16	1,642.31	2,726.97
4	Paid-up Equity Share Capital	8,259.19	6,285.50	6,285.50
5	Reserves excluding Revaluation reserves	79,839.99	50,475.60	51,492.84
6	Networth	88,099.18	56,761.10	57,778.34
7	Paid up Debt capital/Outstanding debt	2,11,885.37	2,49,877.91	2,37,976.75
8	Debt equity ratio	2.41	4.40	4.12
9	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -			
	Basic and Diluted	0.46	2.69	4.40

Notes

- a) The above is an extract of the detailed format of Half Yearly Financial Results filed with the Stock Exchange under Regulation 52 on the websites of BSE Limited and the Company at www.bseindia.com and www.avanse.com respectively.
- b) For the items referred in sub-clauses (a), (b), (d) and (e) of the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to BSE Limited and can be accessed on www.bseindia.com
- c) Capital Redemption Reserve, Debenture Redemption Reserve, Debt Service Coverage Ratio and Interest Service Coverage Ratio are not applicable as per Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.
- d) Previous period/year figures have been regrouped / reclassified wherever necessary to correspond with the current year

For Avanse Financial Services Ltd

Neeraj Swaroop Chairperson (DIN 00061170)

SHYAM CENTURY FERROUS LIMITED

CIN: L27310ML2011PLC008578

Regd.Office: Vill.: Lumshnong, PO: Khaliehriat, Dist. East Jaintia Hills, Meghalaya - 793210 Phone: 0365-278215, Fax: (033)22483539

Email: investors@shyamcenturyferrous.com; website: www.shyamcenturyferrous.com

Extract of Unaudited Financial Results for the Quarter/Half Year ended 30th September, 2019

(₹ in Lacs)

		9	TANDALON	E		CONSOLIDATED					
	Quarte	r ended	Half year ended		Year ended	Quarter ended		Half year ended		Year ended	
Particulars	30.09.2019 Unaudited	30.09.2018 Unaudited	30.09.2019 Unaudited	30.09.2018 Unaudited	31.03.2019 Audited	30.09.2019 Unaudited	30.09.2018 Unaudited	30.09.2019 Unaudited	30.09.2018 Unaudited	31.03.2019 Audited	
Total Income from Operations	2,534.38	2,870.41	3,888.56	6,696.57	13,443.78	2,534.38	2,870.41	3,888.56	6,696.57	13,443.78	
Net Profit/(Loss) for the period (before tax, exceptional items and or extraordinary items)	(231.83)	126.90	(490.23)	991.18	1,479.38	(231.83)	126.90	(490.23)	991.18	1,479.38	
Net Profit/(Loss) for the period (before tax, after exceptional items and or extraordinary items)	(231.83)	126.90	(490.23)	991.18	1,479.38	(231.83)	126.90	(490.23)	991.18	1,479.38	
Net Profit/(Loss) for the period (after tax, exceptional items and or extraordinary items)	(178.07)	137.53	(356.85)	700.91	1,048.01	(178.07)	137.53	(356.85)	700.91	1,048.01	
Net Profit/(Loss) after tax and share of profit/(loss) of associate	(178.07)	137.53	(356.85)	700.91	1,048.01	(106.25)	315.16	(283.76)	997.39	1,667.30	
Total Comprehensive Income for the period (comprising profit/(loss) for the period after tax and other comprehensive income after tax)	(166.78)	132.73	(346.88)	696.65	1,042.79	(94.92)	311.67	(273.81)	994.04	1,661.79	
Paid up Equity Share Capital (Face Value of ₹ 1/- each)	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	
Earnings Per Share (of ₹ 1/- each)											
-Basic & Diluted (Not annualised) (₹)	(0.08)	0.06	(0.16)	0.32	0.47	(0.05)	0.14	(0.13)	0.45	0.75	

NOTES TO FINANCIAL RESULTS

1. The above unaudited financial results as reviewed by Audit Committee have been approved at the meeting of the Board of Directors held on 5th November, 2019. Limited

review of the above results have been carried out by the Statutory Auditors of the Company.

The consolidated results include the result of the company's associate Meghalaya Power Limited (MPL) in which the Company holds 48.80%. The Company has adopted Ind AS 116 'Leases' with effect from April 1, 2019, as notified by the Ministry of Corporate Affairs (MCA) in the Companies (Indian Accounting

Standard) Amendment Rules, 2019 using modified retrospective method. Accordingly, the comparatives have not been retrospectively adjusted. The adoption of this standard did not have any material impact on the profit of the current quarter. The figures for the quarter ended 30 September 2019 are the balancing figures between the unaudited figures for the half year ended 30 September 2019 and unaudited

figures for the quarter ended 30 June 2019. 5. The Company has computed the tax expense of the current financial year as per the tax regime announced under section 115BAA of the Income Tax Act, 1961. Accordingly,

the income tax rate has been considered at 25.17%.

There were no exceptional item during the quarter/half year ended 30th September, 2019.

Figures of the previous period have been regrouped and reclassified to confirm to the classification of current period, wherever necessary The above is an extract of the detailed format of Quarterly Financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and

Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial results are available on the Stock Exchange websites www.nseindia.com and www.bseindia.com and also on the Company's website www.shvamcenturyferrous.com.

By order of the Board For Shyam Century Ferrous Limited Nagraj Tater

(Rs. in lakhs)

Date: 05th November, 2019 Place: Kolkata



Aptus Value Housing Finance India Ltd.
CIN: U65922TN2009PLC073881
8B, 8th Floor, Doshi Towers, 205, Poonamallee High Road, Kilpauk, Chennai - 600 010
Tel: (O) +91 44 4565 0000

Statement of Unaudited Financial Results for the six months ended September 30, 2019

Standalone Consolidated Six months Six months Six months Six months Year Year **Particulars** ended ended ended 31.03.2019 30.09.2019 30.09.2018 31.03.2019 30.09.2019 30.09.2018 Unaudited Unaudited Audited Unaudited Unaudited Audited 23,694.92 Total Income from Operations 21,218.73 14,360.53 31,870.85 14,932.18 33,795.20 2. Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 9,024.64 6,199,51 14,005.10 10.561.13 6.689.97 15,299.74 3. Net Profit / (Loss) for the period before tax 15,299.74 (after Exceptional and/or Extraordinary items) 9,024.64 6,199.51 14,005.10 10.561.13 6.689.97 Net Profit / (Loss) for the period after tax 6,983.28 4,416.63 8,129.03 4.809.07 11,170.09 (after Exceptional and/or Extraordinary items) 10.265.50 5. Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and 4.416.63 6.977.48 10,262.01 4.809.07 8.123.24 11.166.60 Other Comprehensive Income (after tax)] 6. Paid-up equity share capital (Rs. 10/- per share) 9,414.08 7,878.26 7,878.26 9,414.08 7,878.26 7,878.26 7. Reserve (excluding Revaluation Reserves) 146,149.03 55,091.97 61,013.89 148,262.03 55,548.59 61,981.00 8. Net worth 155,563.11 62,970.23 68.892.15 157,676.10 63.426.85 69.859.26 9. Paid up Debt Capital / Outstanding Debt 118,854.40 154,395.43 181,610.60 121,151.75 159,207.31 166,474,06 10. Debt Equity Ratio 1.07 1.89 2.24 1.15 1.9 2.28 11. Earnings per share (of Rs. 10/- each): (a) Basic (Not annualised for six months) 8.63 13.03 10.04 6.11 14.18 5.6 (b) Diluted (Not annualised for six months) 5.59 8.41 13.00 9.78 6.09 14.15 12. Debt Service Coverage Ratio [(PBT+Interest Expended+ Principal collected from customers)/(Interest Expended+ 1.54 1.69 1.56 1.60 Principal repayment of borrowings)] 1.60 1.71 13. Interest Service Coverage Ratio [(PBT + Interest Expended) / (Interest Expended)] 2.08 2.31 2.26 2.21 2.39 2.35

November 5, 2019

- 1. The above statement of unaudited standalone results for the six months ended September 30, 2019 has been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company, at its meeting held on November 5, 2019 and subjected to limited review by our Statutory Auditors
- 2. During the period, the Company has allotted 1,52,08,121 fully paid-up equity shares of Rs. 10 each at a premium of Rs. 516.03 per share and 15,00,000 partly paid-up equity shares of Rs. 10 each (Paid-up to the extent of Re. 1 per share) on preferential basis. The said allotment has been approved by the Board of Directors at its meeting held on August 8, 2019 and by the shareholders in the Extraordinary General Meeting held on August 19, 2019
- The above Standalone Financial Results is an extract of the detailed format of half yearly financial results filed with the Bombay Stock Exchange under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the half yearly Standalone financial results are available on the websites of the Stock Exchange www.bseindia.com and the Company www.aptusindia.com.
- 4. For the items referred in sub-clauses (a), (b), (d) and (e) of the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchange and can be accessed on the URL www.bseindia.com.
 - 5. Amounts for the comparative periods presented have been reclassified / regrouped, wherever necessary. The figures for the comparative period / year have been reviewed / audited by auditors other than S.R. Batliboi & Associates LLP.

visit us at www.antusindia.com

On behalf of the Board of Directors M. Anandan Chennai



Date: November 5, 2019

Place: Mumbai

Transpek Transpek Industry Limited

Regd. Office: Marble Arch, 6th Floor, Race Course, Vadodara - 390 007. Ph #: (0265) 2335444 **Email**: secretarial@transpek.com; **Website**: www.transpek.com

CINI NO - 1 22205G 11065PI C001343

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2019

CIN NO.: L23203GJ1965PLC001343 (₹in Lakhs)														
	Standalone								Consolidated					
Particulars	Quarter ended 30th September, 2019 (Unaudited)	Quarter ended 30th June, 2019 (Unaudited)	Quarter ended 30th September, 2018 (Unaudited)	Year ended 31st March, 2019 (Audited)	Half Year ended 30th September, 2019 (Unaudited)	Half Year ended 30th September, 2018 (Unaudited)	Quarter ended 30th September, 2019 (Unaudited)	Quarter ended 30th June, 2019 (Unaudited)	Quarter ended 30th September, 2018 (Unaudited)	Year ended 31st March, 2019 (Audited)	Half Year ended 30th September, 2019 (Unaudited)	Half Year ended 30th September, 2018 (Unaudited)		
Revenue from Operations	12,534	11,263	14,323	59,457	23,797	26,091	12,534	11,263	14,323	59,457	23,797	26,091		
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	1,888	425	1,697	10,131	2,313	3,199	1,888	425	1,697	10,131	2,313	3,199		
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	1,888	425	1,697	10,131	2,313	3,199	1,888	425	1,697	10,131	2,313	3,199		
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	1,546	335	1,093	6,574	1,881	2,121	1,546	335	1,093	6,574	1,881	2,121		
Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,527	75	1,560	7,053	1,602	3,130	1,527	75	1,560	7,053	1,602	3,130		
Equity Share Capital	559	559	559	559	559	559	559	559	559	559	559	559		
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	30,582	-	-	-	-	-	30,582	-	<u>-</u>		
Earnings Per Share (of Rs.10/- each)														
Basic & Diluted (Rs.)	27.66	6.00	19.54	117.69	33.66	37.95	27.66	6.00	19.54	117.69	33.66	37.95		

Notes:

The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results is available on the Company's website at www.transpek.com and the Stock Exchange's Website at www.bseindia.com.

DATE: 4th November 2019 PLACE: Mumbai

For TRANSPEK INDUSTRY LIMITED **BIMAL V. MEHTA**

MANAGING DIRECTOR DIN:00081171

Chairman & Managing Director